

B.Com. Semester - 1 (CBCS) Examination
Jan/Feb.-2022 (NEW COURSE)
ACCOUNTING - 1(ELECTIVE-1)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન-૧ પવન અને પરાગ ૩:૨ ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચતા એક સોલિસિટર પેઢીના ભાગીદારો છે. (૧૪)
 તા. ૩૧-૩-૨૦૨૦ના રોજનું પેઢીનું કાચું સરવૈયું નીચે પ્રમાણે હતું.

ઉધાર બાકી	રૂ.	જમા બાકી	રૂ.
ઓફિસ મકાન	30,00,000	મૂડી: પવન	20,00,000
પુસ્તકો	2,20,000	પરાગ	15,00,000
વાહનો	5,00,000	અસીલ એડવાન્સ	50,000
ઉપાડ: પવન	30,000	લેણદારો	10,000
પરાગ	20,000	કુલ ફી	8,00,000
અસીલોનાં ખાતાં	3,00,000	ફી અંગેનું અનામત (1-4-'19)	2,00,000
સ્ટેશનરી	30,000	શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ	20,000
પગાર	40,000		
અસીલ પર ખર્ચ ખાતાવહી	50,000		
બાકી ફીના દેવાદારો	1,20,000		
ઓફીસ ખર્ચ	1,00,000		
પરચૂરણ ખર્ચ	70,000		
મેગેઝિન લવાજમ	20,000		
તાર ટપાલ	5,000		
બેંક સિલક	75,000		
	45,80,000		45,80,000

વધારાની માહિતી:

1. શિખાઉ ઉમેદવારને તા. 1-4-2018થી ત્રણ વર્ષ માટે રાખેલ છે.
2. ઓફિસ મકાન, પુસ્તકો અને વાહનો પર 10% ઘસારો ગણેલ છે.
3. મૂડી પર અને ઉપાડ પર 5% વ્યાજ ગણો
4. અધુરા કામની ફી રૂ. 20,000 વર્ષના અંતે બાકી છે.
5. અસીલો પાસેથી પરચૂરણ ખર્ચ પેટે મળેલ રૂ. 15,000 નો સમાવેશ અસીલ એડવાન્સમાં કરેલ છે.
6. અસીલ વતી ચૂકવેલ રૂ. 5,000 ઓફીસ ખર્ચ ખાતે લખાયેલ છે.

ઉપરની વિગતો ધ્યાનમાં લઈ ૩૧-૩-૨૦૨૦ ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો રોકડ પદ્ધતિએ તૈયાર કરો.

પ્રશ્ન-૨ તા. 1-4-2016 ના રોજ મોહને માધવ ટ્રેડર્સ પાસેથી એક મોટરકાર ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદી અને (૧૪) ડિલિવરી લેતી વખતે રૂ. 5,20,000 ચૂકવ્યા. બાકીની રકમ નીચે મુજબ ચૂકવી હતી. જેમાં બાકી રોકડ કિંમત પર 10% વાર્ષિક વ્યાજનો સમાવેશ થાય છે.

31-3-2017	રૂ. 5,88,000	31-3-2019	રૂ. 5,04,000
31-3-2018	?	31-3-2020	રૂ. 4,62,000

મોહન ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ વાર્ષિક 15% લેખે ઘસારો ગણે છે. દર વર્ષે 31મી માર્ચના રોજ હિસાબો બંધ થાય છે.

ખરીદતી વખતે પૂરેપૂરી ખરીદકિંમત ઉધારવામાં આવે છે. તા. 31-3-2018 ના રોજ નીચેની આમનોંધ આપવામાં આવેલ છે.

ઘસારા ખાતે ઉ. 2,80,500

તે મોટરકાર ખાતે 2,80,500

તમારે મોહનના ચોપડે મોટરકારનું ખાતું તેમજ માધવ ટ્રેડર્સનું ખાતું તૈયાર કરવાનું છે.

પ્રશ્ન-૩ જહાજ જલસમ્રાટની તા. 18-1-2020 થી તા. 31-3-2020 સુધીની સફરની માહિતી નીચે મુજબ છે, તે (૧૪) પરથી તેનું સફર ખાતું તૈયાર કરો.

	રૂ.		રૂ.
કોલસાનો શરૂઆતનો સ્ટોક	22,000	બંદર ખર્ચા	3,150
કોલસાની ખરીદી	18,000	પરચૂરણ ખર્ચા	970
મજૂરી	7,500	કેપ્ટનનો પગાર (વાર્ષિક)	55,000
વહિવટી ખર્ચા (વાર્ષિક)	4,500	ટપાલ ભાડું	2,400
મુસાફર ભાડું	9,600	કેપ્ટનના ખર્ચા	1,130
નૂરનો વીમો	2,550	નૂર પર 2% લેખે દલાલી	2,400

અન્ય માહિતી:-

1. જતી અને વળતી વખતનું નૂર 3:1 ના પ્રમાણમાં હતું.
2. એડ્રેસ કમિશન જતી વખતના નૂર ઉપર 5% અને વળતી વખતના નૂર પર 3% ગણવામાં આવે છે.
3. વહાણની કિંમત રૂ. 5,00,000 ની છે. વહાણ પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવામાં આવે છે.
4. તા. 31-3-2020 ના રોજ હાથ પર કોલસાની કિંમત રૂ. 5,000 આંકવામાં આવી હતી.
5. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 4% કમિશન આપવાનું છે.

પ્રશ્ન-૪ એક ઉત્પાદક પેઢીના માર્ચ, 2020ના રોજ પૂરા થતાં ત્રણ માસના ઉત્પાદન અંગે કાચા માલની આવક- (૧૪) જાવકની માહિતી નીચે મુજબ છે.

2020

જાન્યુઆરી	2:	શરૂઆતની બાકી	100 કિલો	રૂ. 4 ના ભાવે
	6:	પૂરો પાડેલ માલ	50 કિલો	
ફેબ્રુઆરી	1:	માલની ખરીદી	150 કિલો	રૂ. 5 ના ભાવે
	8:	પૂરો પાડેલ માલ	100 કિલો	
	25:	પૂરો પાડેલ માલ	50 કિલો	
માર્ચ	5:	માલની ખરીદી	100 કિલો	રૂ. 6 ના ભાવે
	27:	પૂરો પાડેલ માલ	75 કિલો	

ઉપરની માહિતી પરથી લિફો પદ્ધતિ (LIFO) અનુસાર પૂરા પાડેલ માલની કિંમત ગણવામાં આવે છે એમ માનીને સ્ટોક પત્રક તૈયાર કરો અને તા. 31-3-2020 ના રોજ સ્ટોકની કિંમત જણાવો.

1. વ્યવસાયી વ્યક્તિઓના હિસાબો રાખવાની પદ્ધતિ જણાવો.
2. નોંધ લખો. ભાડે ખરીદ પદ્ધતિ
3. પ્રાઈમેજ અને એડ્રેસ કમિશન
4. ઈન્વેન્ટરીનો અર્થ આપી ઈન્વેન્ટરીના મૂલ્યાંકનના હેતુઓ જણાવો.

English Version

- Que-1 Pavan and Parag are the partners of a solicitor firm, sharing profit and loss in the ratio of 3:2. (14)
The trial balance of their firm as on 31-3-2020 was as follow.

Trial Balance on 31-3-2020

Debit balance	Rs.	Credit balance	Rs.
Office Building	30,00,000	Capital: Pavan	20,00,000
Books	2,20,000	Parag	15,00,000
Vehicles	5,00,000	Client advance	50,000
Drawing: Pavan	30,000	Creditors	10,000
Parag	20,000	Total fees	8,00,000
Client A/cs	3,00,000	Reserve on fees (1-4-'19)	2,00,000
Stationery	30,000	Apprentice premium	20,000
Salary	40,000		
Client miscellaneous expenses ledges	50,000		
Debtors of outstanding fees	1,20,000		
Office expenses	1,00,000		
Miscellaneous expenses	70,000		
Subscription for magazines	20,000		
Postage charges	5,000		
Bank Balance	75,000		
	45,80,000		45,80,000

Additional information:

1. An apprentice is enrolled on 1-4-2018 for three years
 2. Charge depreciation at 10% on office building, books and vehicles
 3. Calculate interest at 5% on Capital and drawings
 4. At the end of the year incomplete work is Rs. 20,000
 5. Rs. 15,000 received from a client for paying miscellaneous expenses on behalf of him are included in advance from clients
 6. Rs. 5,000 paid for expenses on behalf of clients were included in office expenses.
- Prepare final accounts of the firm on cash basis for the year ending on 31-3-2020.

- Que-2 Mohan purchased a motorcar from Madhav traders under the hire-purchase system on 1-4-2016 and Rs. 5,20,000 was paid at the time of delivery. The remaining amount was paid in the following instalments with interest at 10% p.a. on outstanding cash price. (14)

31-3-2017	Rs. 5,88,000	31-3-2019	Rs. 5,04,000
31-3-2018	?	31-3-2020	Rs. 4,62,000

Mohan is computing the depreciation every year at 15% p.a. under written down value method. Accounts are closed on 31st March every year. Full cash price is debited to motorcar accounts at the time of purchase.

Following journal Entry was found from his Books of Accounts on 31-3-2018.

Depreciation A/c	Dr. 2,80,500	
To Motor Car A/c		2,80,500

You are required to prepare Motor Car A/c and Madhav Traders A/c in the books of Mohan

- Que-3 The following particulars are related to the ship Jalsamrat. Prepare Voyage Account. Period of Voyage from 18-1-2020 to 31-3-2020. (14)

	Rs.		Rs.
Opening stock of coal	22,000	Port charges	3,150
Purchase of coal	18,000	Sundry expenses	970
Wages	7,500	Captain's salary (yearly)	55,000
Administrative exp. (Yearly)	4,500	Mail money	2,400
Passage money	9,600	Captain's expenses	1,130
Freight Insurance	2,550	Brokerage at 2% on freight	2,400

Additional Information:-

1. The ratio of freight was 3:1 for outward and inward journey.
2. Address commission is to be charged at 5% on outward freight and 3% on inward freight
3. The cost of ship is Rs. 5,00,000 and depreciation is calculated at 10% p.a.
4. The stock of coal was Rs. 5,000 on 31-3-2020.
5. The manager is to be given 4% commission on the net profit after charging such commission.

- Que-4 The following is the receipts and issues of a certain material in a trading concern for quarter ending on 31st March, 2020. (14)

2020

January	2:	Opening balance	100 kgs	at Rs. 4 per Kg.
	6:	Issued	50 kgs	
February	1:	Purchased	150 kgs	at Rs. 5 per Kg.
	8:	Issued	100 kgs	
	25:	Issued	50 kgs	
March	5:	Purchased	100 kgs	at Rs. 6 per Kg.
	27:	Issued	75 kgs	

From the above mentioned information you are required to prepare stock register assuming that issues are priced on LIFO Method and state the value of stock on 31st March, 2020.

- Que-5 Answer the following questions. (any two) (14)

1. Discuss the Book-Keeping System of professional persons.
2. Write note on: Hire Purchase System
3. Primage and Address Commission
4. Give the meaning of inventory, Discuss objectives of Inventory valuation
